

**C.U.SHAH UNIVERSITY**  
**Winter Examination-2022**

**Subject Name: Fundamentals of Structure and Mechanical Engineering**

**Subject Code: 2TE01FSM1**

**Branch: Diploma (Mechanical)**

**Semester: 1**

**Date: 12/01/2023**

**Time: 11:00 To 02:00**

**Marks: 70**

**Instructions:**

- (1) Use of Programmable calculator & any other electronic instrument is prohibited.
  - (2) Instructions written on main answer book are strictly to be obeyed.
  - (3) Draw neat diagrams and figures (if necessary) at right places.
  - (4) Assume suitable data if needed.
- 

**Q-1      Attempt the following questions: (14)**

- a) Which gas is not used in gas welding  
A) hydrogen    B) oxygen    C) Nitrogen    D) acetylene
- b) Which of the following is not used in CI engine?  
A) flue pump    B) spark plug    C) crank shaft    D) fuel injector
- c) Which of the following devices is used to increase the temperature of saturated steam without raising its pressure?  
A) superheater    B) fusible plug    C) Air preheater    D) blow off cock
- d) Which property of the fluid offers resistance to deformation under the action of shear force?  
A) density    B) permeability    C) specific gravity    D) viscosity
- e) Which gears are used to connect two intersecting shaft axes?  
A) Crossed helical gear    B) Worm and worm wheel  
C) Bevel gears    D) All of the above
- f) Which of the following is not a main element of FRL unit of air compressor?  
Air filter    B. pressure regulator    C. control valve    D. lubricator
- g) Which one is not included in geotechnical engineering?  
A) measurement of rain water    B) soil investigation    C) soil bearing capacity    D) design of different type of foundation
- h) Which of the following machine need foundation?  
A) compressor testing machine    B) universal testing machine    C) rotary compressor  
D) all of above
- i) Which of the following details is not shown in site plan?  
A) area of plot    B) south direction    C) plot No.    D) address of plot
- j) According to IS, the normal size of bricks is.  
A) 20 x 10 x 10 cm    B) 20 x 10 x 20 cm    C) 10 x 10 x 20 cm    D) 10 x 20 x 10 cm
- k) In chain surveying field work is limited to  
  
A) both linear and angular measurements                  B) angular measurements only  
  
C) linear measurements only                                  D) all the above
- l) In quadrant bearing system, a whole circle bearing of  $293^{\circ}30'$  can be expressed as  
A)  $W23^{\circ}30'$     B)  $N66^{\circ}30' W$     C)  $S113^{\circ}30'$     D)  $N23^{\circ}30' W$



- m) In fire tube boilers, pressure is limited to  
 A) 16 bar      B) 32 bar      C) 48 bar      D) 64 bar
- n) The gear used to convert rotary motion into translating motion is  
 A) Worm and wheel    B) Crown gear    C) Rack and pinion    D) Spiral Bevel gear

**Attempt any four questions from Q-2 to Q-8**

<b>Q-2</b>	<b>Attempt all questions</b>	
A	Explain different types of civil engineering structures.	<b>07</b>
B	Give the difference between map and plan	<b>07</b>
<b>Q-3</b>	<b>Attempt all questions</b>	
A	Write the meaning of following abbreviations ASB, CONC, DPC, RLY RWP, SPEC	<b>03</b>
B	Give the classification of bricks according to its quality and application	<b>04</b>
C	Give the difference between lime and cement.	<b>07</b>
<b>Q-4</b>	<b>Attempt all questions</b>	
A	Write a procedure of using a prismatic compass.	<b>07</b>
B	Explain the effect of dynamic forces on machine foundation.	<b>07</b>
<b>Q-5</b>	<b>Attempt all questions</b>	
A	Define welding and explain submerged arc welding with a neat sketch.	<b>07</b>
B	Explain the working principle of a four stroke petrol engine.	<b>07</b>
<b>Q-6</b>	<b>Attempt all questions</b>	
A	Explain the working of the steam engine with a neat sketch.	<b>07</b>
B	Give the classification of boilers.	<b>07</b>
<b>Q-7</b>	<b>Attempt all questions</b>	
A	Write a basic concept of fluid flow.	<b>07</b>
B	Explain working of centrifugal pump with neat sketch	<b>07</b>
<b>Q-8</b>	<b>Attempt all questions</b>	
A	Write advantages and disadvantages of pneumatic system	<b>03</b>
B	Write importance and application of power transmission.	<b>04</b>
C	Explain types of gear trains	<b>07</b>

## ગુજરાતી

પ્ર.૧	નીચેનાબધાપ્રક્રિયાનાજવાબલખો.	(૧૪)
ક	નીચેનામાંથીક્યોગેસ, ગેસવેલ્ડીંગમાંવપરાતોનથી?	
	અ) હાઇડ્રોજનબ) ઓક્સીજનક) નાઇડ્રોજનડ) એસીટીલીન	
ખ	નીચેનામાંથી CIએન્જિનમાંશુંનથીહોતું?	
	અ) ફ્યુલપંપબ) સ્પાર્કપ્લગક) કેકશાફ્ટડ) ફ્યુલઈનજેક્ટર	
ગ	નીચેનામાંથીક્યુંસાધનવરાળનુંદબાણવધાર્યવગારવરાળનુંતાપમાનવધારવામાટેવપરાયછે	
	અ) સુપરહીટરબ) ફ્યુલબલપ્લગક)એરપ્રીહીટરડ) બ્લોઓફકોક	
ઘ	પ્રવાહિનોક્યોગુણધર્મક્રિયરબળનીકિયાહેઠળવિરુપણસામેપ્રતિકારઆપેછે?	



- અ) ધનતાબ) અભેદતાક) ચોક્કસગુરૂત્વાકર્ષણા) સ્નીગ્ધતા
- ચ બેઇન્ટરસેક્ટિંગશાફ્ટનેજોડવામાટેક્યાગીયરવપરાયછે?
- અ) કોસહેલીકલગીયરબ) વોર્મઅનેવોર્મફીલ  
ક) બેલગીયરડ) ઉપરનાબધા
- છ નીચેનામાંથીકયોએરકોમ્પ્રેસરનાFRLયુનિટનોમુખ્યઘટકનથી?
- અ) એરફિલ્ટરબ) પ્રેસરરેગ્યુલેટરક) કંટ્રોલવાલ્વડ) લુબ્બિકેટર
- જ નીચેનામાંથીજીયોટેકનિકલમાંશેનોસમાવેશથતોનથી?
- અ) વરસાઈપાણીનીમાપણીબ) માટીનીતપાસ  
ક) માટીનીબારધારણક્ષમતાડ) વિવિધપ્રકારનાપાયાનીડિઝાઇન
- ઝ નીચેનામાંથીક્યામશીનનેફાઉન્ડેશનનીજરૂરપડેછે?
- અ) કોમ્પ્રેસરટેસ્ટીંગમશીનબ) યુનિવર્સલટેસ્ટીંગમશીન  
ક) રોટરીકોમ્પ્રેસરડ) ઉપરનાબધા
- ટ નીચેનામાંથીકઈમાહિતીસાઈટપ્લાનમાંદર્શાવેલીહોતીનથી?
- અ) પ્લોટનુંક્ષેત્રફળબ) દ્યક્ષિણાદિશાક) પ્લોટનંબરડ) પ્લોટનુંસરનામું
- સ IS પ્રમાણેઈટનીનોર્મલસાઈઝ
- અ) ૨૦ x ૧૦ x ૧૦સેમીબ) ૨૦ x ૧૦ x ૨૦સેમી  
ક) ૧૦ x ૧૦ x ૨૦સેમીડ) ૧૦ x ૨૦ x ૧૦સેમી
- સ સાકળસર્વેક્ષણમાંક્ષેત્રકામશેનાપુરતુંમાર્યાદિતહોયછે?
- અ) રેખીયઅનેકોણીયબંનેનીમાપણીબ) માત્રકોણીયમાપણી  
ક) માત્રરેખીયમાપણીડ) ઉપરનાબધા
- ફ વૃતપાતબેરીગમાં, પૂર્વવૃતપબેરીગા293°30' કઈરીતેદર્શાવાય ?
- અ)W23°30' બ) N66°30' ક) S113°30' સ) N23°30'W
- ણ ફાયરટયુબબોઇલરનુંપ્રેસરકેટલુંહોયછે?
- અ) ૧૬બારબ) ૩૨બારક) ૪૮બારડ) ૬૪બાર
- ત રોટરીગતિરેખીયગતિમાંકેરવવામાટેક્યાગીયરવપરાય ?
- અ) વોર્મઅનેવોર્મફીલબ) કાઉનગીયર  
ક) રેકઅનેપીનીયનડ) સ્પાઈરલ
- પ્ર. ૨થીપ્ર. ૮માંથીકોઈપણચારપ્રશ્નોનાજવાબલખો.

પ્ર.૨ નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.

A જુદાજુદાપ્રકારનાસિવિલઇજનેરીબાંધકામોસમજાવો. 09

B નકશોઅનેપ્લાનવચ્ચેનોતફાવતલખો. 09

પ્ર.૩ નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.

A નીચેનાએબ્લીવિએશનનુંઅર્થઘટનલખો. 03

ASB, CONC, DPC, RLY RWP, SPEC



B	ગુણવત્તાઅનેઉપયોગીતાનેઆધારેઈટોનુંવગ્રીકરણલખો.	08
C	ચૂનોઅનેસિમેન્ટવચ્ચેનોતફાવતલખો.	09
પ્ર.૪	નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.	
A	પ્રીઝમેટીકંપાસનોઉપયોગકરવાનીપદ્ધતિલખો.	09
B	વિવિધપ્રકારનાગતિશીલબળોનીપાયાઉપરથતીઅસરોસમજાવો.	09
પ્ર.૫	નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.	
A	વેલ્ડીંગનીવ્યાખ્યાલખોઅનેસબમર્જડાર્કવેલ્ડીંગસ્વચ્છઆકૃતિસાથેસમજાવો.	09
B	ફોરસ્ટ્રોકપેટ્રોલએન્જિનનોકાર્યપદ્ધતિસાથેસમજાવો.	09
પ્ર.૬	નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.	
A	સ્ટીમએન્જિનનીકાર્યપદ્ધતિઆકૃતિસાથેસમજાવો.	09
B	બોઇલરનુંવગ્રીકરણલખો.	09
પ્ર.૭	નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.	
A	ફલ્યુઇડફલોનોસામાન્યખ્યાલલખો.	09
B	સેન્ટ્રીફલ્યુગલપંપનીકાર્યપદ્ધતિઆકૃતિસમજાવો	09
પ્ર.૮	નીચેનાબધાપ્રશ્નોનાજવાબલખો.	
A	ન્યુમેટીકસીસ્ટમનાફાયદાઅનેગેરફાયદાલખો.	03
B	પાવરટ્રાન્સમીશનનુંમહત્વઅનેઉપયોગીતાસમજાવો.	08
C	ગીયરટ્રેઇનનાપ્રકારોસમજાવો.	09

